https://archive.org/details/bk1421/page/n0/mode/1up

2015-10 -Satpanth Prakash (1421)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

વર્ષ : ૪, અંક : ૮, સળંગ અંક : ૪૪, દર માસની ૧૫ તારીખે પ્રગટ થતું માસિક ઓક્ટોબર-૨૦૧૫

સતપંથ પ્રકાશ

પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ તથા મા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ
(ધર્મસત્તા અને રાજસત્તાની વૈચારિક ગોષ્ઠી)
મહિલા સમન્વય અખિલ ભારતીય કાર્યશાળા પ્રસંગે (તા. ૧૨-૧૩-૧૪ સપ્ટેમ્બર-૨૦૧૫)
પ્રેરણાપીઠ, પીરાણા - કર્ણાવતી - અમદાવાદ (ગુજરાત)

છૂટક કિંમત રૂા. ૯/-, વા.લ. રૂા.૧૦૦/-

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1421/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1, 4, 8.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v18.py

https://archive.org/details/bk1421/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.23 15:06:25 +05'30'

2015-10 -Satpanth Prakash (1421)

realpatidar.com

વર્ષ : ૪, અંક : ૮, સળંગ અંક : ૪૪, દર માસની ૧૫ તારીખે પ્રગટ થતું માસિક ઓક્ટોબર-૨૦૧૫

સતપંથ પ્રકાશ

Nanakdas Kaka with Gujarat CM Anandiben Patel

પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ તથા મા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ
(ધર્મસત્તા અને રાજસત્તાની વૈચારિક ગોષ્ઠી)
મહિલા સમન્વય અખિલ ભારતીય કાર્યશાળા પ્રસંગે (તા. ૧૨-૧૩-૧૪ સપ્ટેમ્બર-૨૦૧૫)
પ્રેરણાપીઠ, પીરાણા - કર્ણાવતી - અમદાવાદ (ગુજરાત)

છૂટક કિંમત રૂ. ૯/-, વા.લ. રૂ.૧૦૦/-

realpatidar.com

https://archive.org/details/bk1421/page/n3/mode/1up

realpatidar.com

મહિલા સમન્વય - અખિલ ભારતીય કાર્યશાળા

પ્રેરણાપીઠ - પીરાણા - અમદાવાદ (તા. ૧૨-૧૩-૧૪ સપ્ટેમ્બર - ૨૦૧૫)

આગમન

મંચસ્થ બિરાજમાન પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ,
મા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ
તેમજ મહિલા કાર્યકર્તા બહેનો.

ઉપરોક્ત પ્રસંગે દીપ પ્રાગટ્ય

ઉપરોક્ત પ્રસંગે પૂ. જગદ્‌ગુરુ શ્રી મા. મુખ્યમંત્રીશ્રીનું
શાલ દ્વારા સન્માન કરે છે.

પ્રાસંગિક પ્રવચન કરી રહેલ
મા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ

ઉપરોક્ત પ્રસંગે સમગ્ર ભારતમાંથી
પધારેલ મહિલા કાર્યકર્તા બહેનો

પૂ. જગદ્‌ગુરુ શ્રી, મા. મુખ્યમંત્રીશ્રી આનંદીબહેન પટેલ,
મા. ધારાસભ્યશ્રી બાબુભાઈ પટેલ,
પ્રેરણાપીઠના ટ્રસ્ટીશ્રીઓ વગેરે.

સદ્‌ગુરુશ્રી ઈમામશાહ મહારાજની સમાધિએ
દર્શન કરી રહેલ મા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ,
મા. ધારાસભ્યશ્રી બાબુભાઈ, ટ્રસ્ટીશ્રી મોહનભાઈ વગેરે.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1421/page/n4/mode/1up

2015-10 -Satpanth Prakash (1421)

realpatidar.com

સત્પંથ પ્રકાશ

વર્ષ : ૪, અંક : ૮, સળંગ અંક : ૪૪, ઓક્ટોબર - ૨૦૧૫

:: સ્થાપકશ્રી ::
શ્રી શામજીભાઈ કે. પટેલ - વડાગામ

:: સંપાદકશ્રી ::
શ્રી શાંતિભાઈ ડી. માકાણી - મુંબઈ

:: સહ સંપાદકશ્રી ::
શ્રી બાબુભાઈ એસ. છાભૈયા - અમદાવાદ

:: સત્પંથ પ્રકાશન સમિતિ ::

:: પ્રમુખશ્રી ::
શ્રી મનોજભાઈ એન. રામજીયાણી - વડોદરા

:: મંત્રીશ્રી ::
શ્રી જશુભાઈ કે. ભોજાણી - વિઠ્ઠલપુરા લાટ

:: સહ મંત્રીશ્રી ::
શ્રી સુરેશભાઈ એમ. પોકાર - અમદાવાદ

:: સદસ્યશ્રીઓ ::
શ્રી પ્રિ. સુરેશભાઈ એસ. રામજીયાણી - ખેડબ્રહ્મા
શ્રી જેઠાલાલ કે. સેંઘાણી - માંડવી
શ્રી નારણભાઈ ડી. વેલાણી - પૂના
શ્રી અંબાલાલ પી. ચૌધરી - રામપીરકંપા
શ્રી અમૃતલાલ જે. રૂડાણી - નાના અંગીયા
શ્રી હર્ષદકુમાર જે. છાભૈયા - પીરાણા લાટ

:: સલાહકારશ્રીઓ ::
શ્રી શામજીભાઈ એલ. ધોળુ - વડોદરા
શ્રી કરશનભાઈ વી. છાભૈયા - ધનસુરા

:: સત્પંથ પ્રકાશ - લવાજમ દર ::

		ભારતમાં		વિદેશમાં
વાર્ષિક	:	૧૦૦=૦૦	:	૭૦૦=૦૦
ત્રિવાર્ષિક	:	૨૫૦=૦૦	:	૧૮૦૦=૦૦
આજીવન	:	૮૫૦=૦૦	:	૪૦૦૦=૦૦
અમર	:	૧૫૦૦=૦૦	:	૭૦૦૦=૦૦

:: પ્રકાશક ::
સત્પંથ પ્રકાશન સમિતિ,
પ્રેરણાપીઠ-પીરાણા, તા. દસક્રોઈ, જિ. અમદાવાદ-૩૮૨૪૨૫.

E-mail : prernapith@gmail.com
(Contact : Mob. No. 9909508029)

Website : www.nishklankinarayan.com

કુરીયર્સ : મારૂતિ કુરીયર્સ, બારેજા - અમદાવાદ.
C/o. સત્પંથ પ્રકાશન સમિતિ, પ્રેરણાપીઠ-પીરાણા.
સંપર્ક : ધર્મેન્દ્ર પટેલ - બુક સ્ટોલ
મો. ૯૪૨૭૩૭૧૯૪૦ ફોન : ૦૨૭૧૮-૨૮૮૮૧૨

ડીઝાઈન અને ટાઈપ સેટીંગ : કપીલ ચૌહાન (મો.) ૯૩૭૭૧૭૮૫૮૫

મુદ્રક : સ્મૃતિ ઓફસેટ : બી-૫/૬/૭, રવિ એસ્ટેટ, રૂસ્તમ મિલ કંપાઉન્ડ, ટોરેન્ટો પાવરની બાજુમાં, દુધેશ્વર, અમદાવાદ-૩૮૦૦૦૪, ફોન : (૦૭૯) ૨૫૬૩૦૩૭૨/૭૩

મૂળ ક્રમ : વર્ષ : ૨૨, અંક : ૧૨, સળંગ અંક : ૨૬૪

સંપાદકીય.....

પ્રેરણા

॥ ૐ શ્રી નિષ્કલંકી નારાયણાય વિજયેતેતરામ ॥

શ્રેષ્ઠ અને વિદ્વાન વ્યક્તિઓનું એ કર્તવ્ય છે કે તેઓ પોતાના અર્જિત જ્ઞાનનો ઉપયોગ ફક્ત પોતાની સ્થાર્થ પૂર્ત માટે જ ન કરે પરંતુ પોતાના સંપર્કમાં આવવાવાળા બધા લોકોને તેનો લાભ આપે. જ્ઞાન આપવાથી ઘટતું નથી વધે જ છે. એનાથી બંનેને લાભ થાય છે. દુર્ગુણોનો નાશ અને સદ્‌ગુણોની વૃદ્ધિથી લોકોની વિવેકબુદ્ધિ જાગૃત થાય છે. જેનાથી વિદ્યા અને બળ વધે છે તથા મનુષ્ય સત્કર્મ કરતાં કરતાં દીર્ઘાયુને પ્રાપ્ત કરે છે.

જે માણસ પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ બીજાઓને આપવામાં કંજૂસાઈ કરે છે તેઓ પશુ સમાન જ છે. તેમનું સંચિત જ્ઞાન સ્વયં તેમના પોતાના જ કામમાં આવતું નથી અને ધીરે ધીરે તેની પ્રખરતા નષ્ટ થતી જાય છે. જે જ્ઞાન પ્રાપ્ત કર્યુ છે તેનાથી આખાય સમાજને લાભાન્વિત કરવો મનુષ્યનો ધર્મ છે. તેઓ જ સાચા વિદ્વાન કહેવાય છે.

આવા જ્ઞાની અને વિદ્વાન માણસોના સંસર્ગથી હંમેશાં જ મનુષ્યમાં દાનશીલતા તથા અહિંસાની ભાવના અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. સત્સંગ હંમેશાં મનુષ્યનો ઉદ્ધાર કરે છે. સત્સંગના કારણે મોટામાં મોટા પતિત માણસોએ પણ નરક જીવનમાંથી ઊંચા ઊઠીને સ્વર્ગીય જીવન પ્રાપ્ત કર્યાં છે. મહાપુરુષોનાં જીવન આવાં ઉદાહરણોથી ભરપૂર છે. મહર્ષિ વાલ્મિકી તેમજ નાયાજી મહારાજનું પૂર્વ જીવન પાપમય હતું પરંતુ સત્સંગે તેમને કેટલા ઉચ્ચ સ્તરના બનાવી દીધા.

ચારિત્ર્યવાન વિદ્વાનોનું આજ કર્તવ્ય છે.

સંપાદક : શ્રી શાંતિભાઈ ડી. માકાણી

●●●

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com
Page 3 of 11

https://archive.org/details/bk1421/page/n5/mode/1up

Satpanth Religious Literature - Shrimad Bhagwat Dahsavatar written by Imamshah

realpatidar.com

સદ્‌ગુરુશ્રી ઈમામશાહ મહારાજ રચિત
"શ્રીમદ્ ભગવત્ દશાવતાર"
(શ્રી નરસિંહ અવતાર)

(ગતાંકથી ચાલુ...)

પ્રહલાદ બાળક થોડો મોટો થયો. એ પોતાની કાલીઘેલી ભાષામાં બધાંના મનને પ્રસન્ન કરવા લાગ્યો. એ પોતાના માતૃશ્રીને અતિશય ગૂઢ એવા જ્ઞાનના પ્રશ્ન પૂછીને ગુંચવણમાં નાખી દેતો. એને શું જવાબ આપવો એના મનનું કઈ રીતે સમાધાન કરવું એ જ એને ખબર પડતી નહોતી. પરમેશ્વરના અવતાર વિષયે લીલાચરિત્ર વિષયે પ્રહલાદ એમને પ્રશ્ન પૂછીને હેરાન કરતો. આમ કાલક્રમણ કરતાં કરતાં પ્રહલાદ પાંચ વર્ષનો થયો. એકવાર માતા પુત્ર કોઈક કારણોસર નગરચર્યા કરવા માટે ગામમાંથી બહારની પુષ્પવાટીકામાં જતાં હતાં. તે વખતે એમણે રસ્તામાં એક કુંભારનો નિંભાડો જોયો. કુંભારનો વ્યવસાય માટલા બનાવવાનો જોરમાં ચાલુ હતો. એમણે એ વખતે એ કાચા માટલાનો મોટો ઢગલો કરી એને અગ્નિ આપી હતી. નિંભાડાને ચોફેર ઘેરીને જ્યાં ત્યાંથી અગ્નિની જ્વાળા નીકળતી હતી. એટલામાં ત્યાંથી આકુળવ્યાકુળ થયેલી એક બિલાડી આવી. એણે મોટે મોટેથી બૂમો પાડીને રડવાની શરૂઆત કરી અને અગ્નિમાં કૂદકો મારવાનો પ્રયાસ કરવા લાગી. ત્યારે કુંભારે તાત્કાલિક એ બિલાડીને પકડીને પૂછ્યું; તું કેમ રડે છે ? આટલો આક્રોશ કરવાનું કારણ શું છે ? એમ પૂછવા લાગ્યો. બિલાડીએ મોટે મોટેથી વિલાપ કરીને કુંભારને કહ્યું કે : 'હે કુંભારદાસ, આ માટલામાંથી એક કાચા માટલામાં મારાં બચ્ચાં રાખેલ છે. અન્ય પ્રાણીઓથી એમનું રક્ષણ થાય માટે આ યુક્તિ કરી હતી પણ એ ન જોતાં તમે એ માટલાને પણ ઢગલામાં મૂકી મારાં સર્વ બચ્ચાંઓનો ઘાત કર્યો છે. હવે હું પણ આ ઢગલામાં પ્રાણત્યાગ કરીને મારા જીવનનો ત્યાગ કરી મારાં બાળકો સાથે પરલોકમાં જાઉં છું.'

આ દુઃખદ હકીકત સાંભળી કુંભારને તો ખૂબ જ લાગી આવ્યું. આ બધી ઘટના પોતાના કારણે થઈ છે એમ માનીને એ આર્તથી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો. એણે બિલાડીને દિલાસો આપતાં કહ્યું કે; આ સર્વ અનર્થનો હું જ કારણભૂત છું. કારણ મૂર્ખપણાથી ન જોતાં મેં બધાં માટલા ઢગલામાં મૂક્યાં, પણ હું તને ભાષ્યદાન આપું છું કે, જ્યાં સુધી આ ઢગલો પૂર્ણ બળી ન જાય ત્યાં સુધી તું ધીરજ રાખ. થનાર વાતોનો કંઈ ઈલાજ નથી થતો. ફક્ત ઈશ્વર પર આપણે સર્વભાવ રાખી એની આરાધના કરવી આજ આપણું કર્તવ્ય છે. જો કાળ ખરેખર જ તારા બાળકોને ખેંચી ગયો હશે તો તેનું પ્રાયશ્ચિત માની હું પણ આ અગ્નિદેવતાને સાક્ષી રાખી પ્રતિજ્ઞા કરું છું કે હું પણ પ્રાણત્યાગ કરીશ. આમ કહી કુંભાર બિલાડીને થોડી શાંત કરી અને આંખો મીંચીને ત્યાં બેસી ભગવાનનું મનોમન ભજન કરવા લાગ્યો. આર્તતાથી એની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યાં. કેટલાક ક્ષણો પછી ઢગલો ઓલવાયો પછી ઠંડો થયો ત્યારે કુંભાર આંખો ખોલીને ભગવાનનું સ્મરણ કરીને એક એક માટલાં કાઢીને જોવા લાગ્યો. બિલાડી પણ જીવથી આકુળ-વ્યાકુળ ઉત્સુકતાથી જોતી હતી. પણ આ શું આશ્ચર્ય ! આટલા ઢગલામાંથી કુંભારે એક કાચું માટલું બહાર કાઢ્યું અને જુએ છે તો તેમાંથી બિલાડીનાં ચારે બચ્ચાં આનંદથી કૂદકા મારે છે. કુંભાર આ આશ્ચર્ય જોઈને હર્ષાતિરેકથી પરમેશ્વરનું ગુણગાન કરતો નાચવા લાગ્યો. બિલાડીને પણ પોતાના બચ્ચાં સુખરૂપ પાછાં મળેલાં જોઈ સ્વર્ગીય આનંદ થયો.

આ ઘટના ક્યાધુ અને પ્રહલાદે જોઈ. નાનકડા બાળક પ્રહલાદે માતાને પૂછ્યું; 'માતા, આટલી પ્રચંડ અગ્નિમાં બચ્ચાં કઈ રીતે જીવતાં રહ્યાં ? પ્રહલાદને

realpatidar.com

https://archive.org/details/bk1421/page/n6/mode/1up

2015-10 -Satpanth Prakash (1421)

નજીક ખેંચી પ્રેમથી એની પીઠ અને મસ્તક પર હાથ ફેરવી માતાએ કહ્યું: 'બેટા ! આ બધો ભગવાન નારાયણના નામનો અને ભક્તિનો મહિમા છે. ભગવાન પોતાના ભક્તોને કદી ભૂલતો નથી. જે ભક્ત એનું જ્યાં જે રીતે આર્તનાદથી સ્મરણ કરશે, ત્યાં દોડતો જઈને ભક્ત પર આવેલ સંકટનું નિવારણ કરે છે. એ નારાયણ સર્વવ્યાપી ચરાચર જગતમાં પૂર્ણ ચૈતન્યરૂપથી ભરેલ છે. બેટા, તું પણ આ જ બુદ્ધિ કાયમ રાખીને નારાયણનું સર્વભૂત પ્રાણીમાત્રમાં દર્શન કર. એટલે એ નારાયણ જ તારું રક્ષણ કરશે.' માતાનો ઉપદેશ ચિત્તમાં ધારણ કરીને અને ગર્ભવાસ વખતે નારદમુનિના ઉપદેશનું સ્મરણ થઈને ભક્ત બાળક પ્રહલાદ નારાયણના સ્મરણ સંકીર્તનમાં મગ્ન થઈ ગયો. સદૈવ આ જ ભાવતંદ્રીત રહીને એ ભગવાનની ભક્તિ કરવા લાગ્યો.

પછી હિરણ્યકશ્યપે બધા દેવોને જીત્યા સર્વલોક જીતીને એ પોતે એના પદનો ઉપભોગ કરવા લાગ્યો. ભગવાનથી એને અતિશય શત્રુત્વ હોવાથી ઋષિમુનિઓને એ કષ્ટ આપવા લાગ્યો. યજ્ઞયાગ બંધ કરાવવા લાગ્યો. ધર્મનો અત્યંત વિરોધી થયો. એના ગુરુ શુક્રાચાર્ય એ વખતે તપશ્ચર્યા કરવા નીકળી ગયા હતા. પોતાના પુત્ર પ્રહલાદને તેણે ગુરુપુત્રો ષણ્ડ અને અમર્કની પાસે શિક્ષણ માટે મૂક્યો હતો. પ્રહલાદ ત્યારે પાંચ વર્ષનો બાળક હતો. એકવાર પ્રહલાદ ઘેર આવ્યો. માતા ક્યાધુએ એને વસ્ત્રાભુષણો પહેરાવ્યાં અને પિતા હિરણ્યકશ્યપ પાસે મોકલ્યો. પિતા પાસે જઈને પ્રહલાદે તેને પ્રણામ કર્યા. હિરણ્યકશ્યપે પ્રહલાદને સ્નેહપૂર્વક પૂછ્યું; 'બેટા, તું જે કંઈ ભણ્યો તેમાંથી એકાદ સારી વાત મને કહે તો.' પ્રહલાદ બોલ્યો; 'પિતાજી, જગતનાં બધાં પ્રાણી સંસારમાં આસકત રહીને સદૈવ ઉદ્વિગ્ન રહે છે. હું તો સર્વકર્તાને જ શ્રેષ્ઠ માનું છું, આ સંસાર પતન કરનાર જળહીન ઊંડા કૂપ પ્રમાણે હોવાથી ઘરનો ત્યાગ કરીને અરણ્યમાં રહીને મનુષ્યએ પરમેશ્વરનું નારાયણનું સ્મરણ ભજન ચિંતન કરવું.' હિરણ્યકશ્યપ જોરથી હસ્યો. એને લાગ્યું કે કોઈ શત્રુએ આપણા આ બાળકના મનને બહેલાવી દીધું છે. એણે ગુરુપુત્રોને સાવધ કર્યા કે; તમે આ બાળકને સુધારો અને દૈત્યકુળમાં ઉપયુક્ત એવા ધર્મ, અર્થ, કામ વગેરે વિષયોનું શિક્ષણ આપો. ગુરુપુત્રો પ્રહલાદને પોતાના આશ્રમમાં પાછા લાવ્યા. એમણે પ્રહલાદને પુછ્યું કે; તને આવું વિપરીત જ્ઞાન કોણે કહ્યું ? પ્રહલાદે કહ્યું; 'ગુરુદેવ, આ હું છું અને એ બીજો છે, આ તો અજ્ઞાન છે. ભગવાનની આ માયાથી જ જીવ મોહિત થાય છે. એ દયામય જીવ પર દયા કરે છે, એનું જ ચિત્ત એ ભગવાનમાં લાગે છે. મારું ચિત્ત તો એની અંત કૃપાથી એ પરમ પુરુષ નારાયણ જોડે ખેંચાયું છે.'

ગુરુપુત્રોએ પ્રહલાદને ખૂબ ધમકાવીને અને સમજાવીને એને અર્થશાસ્ત્ર, દણ્ડનીતિ, રાજનીતિ વગેરે શિક્ષણ આપવા લાગ્યા. ગુરુએ શીખવેલ વિદ્યા પ્રહલાદ લક્ષ્યપૂર્વક ગ્રહણ કરતો હતો. એ ગુરુનું કદી અપમાન કરતો નહોતો. એમણે શીખવાડેલ વિદ્યાનો પણ કદીય તિરસ્કાર કરતો નહોતો, ગુરુપુત્રોએ પોતાના મનમાં વિચાર કર્યો કે, પ્રહલાદ હવે કંઈક સુશિક્ષિત થયો છે માટે દૈત્ય રાજા પાસે લઈ જવામાં વાંધો નથી. આમ વિચાર કરીને પ્રહલાદને હિરણ્યકશ્યપ પાસે લઈ ગયા.

એનો વિનયશીલ સ્વભાવ જોઈને હિરણ્યકશ્યપે ખોળામાં બેસાડીને પૂછ્યું; 'કહે, બેટા, તું પોતાની સમજણ પ્રમાણે ઉત્તમ જ્ઞાન કોને માને છે ?'

પ્રહલાદે કહ્યું; 'ભગવાનનું ગુણગાન અને ચરિત્ર શ્રવણ, એમની લીલાનું અને નામનું કીર્તન કરવું, એ મંગલમય પ્રભુનું સ્મરણ, એમની ચરણોની સેવા, એ પરમપ્રભુની પૂજા, એમની વંદના, એમના પ્રતિ આસ્થા-દાસ્યભાવ, એમનાથી અને એમનું આત્મનિવેદન એ નવધાભક્તિ છે. આ ભક્તિના આશ્રયથી ભગવાનમાં ચિત્ત લગાવવું આ જ સમસ્ત અધ્યયનનું સર્વોત્તમ ફળ હું માનું છું.'

હિરણ્યકશ્યપ તો ગુસ્સાથી લાલપીળો થયો.

https://archive.org/details/bk1421/page/n7/mode/1up

realpatidar.com

એણે ખોળામાંથી બળપૂર્વક ધક્કો મારી પ્રહલાદને જમીન પર પછાડ્યો. એણે ગુરુપુત્રોને ધમકાવીને કહ્યું કે; 'તમે લોકો મારા છોકરાને ઊંધી શિખામણ આપી મારા શત્રુને પોષો છો. તમે એને આવું જ્ઞાન શીખવેલ છે?'

ગુરુપુત્રોએ કહ્યું; 'આમાં અમારો કોઈ દોષ નથી.'

પિતા જોડેથી પણ તિરસ્કૃત થઈને પણ પ્રહલાદ શાંત ઉભો હતો. એના મનમાં કોઈ પણ ક્ષોભ ઉદ્ભવ્યો નહીં. એણે શાંત ચિત્તથી પિતાને કહ્યું: 'પિતાજી, તમે ગુસ્સે થશો નહીં. ગુરુપુત્રોનો કોઈ દોષ નથી. એ લોકો વિષયાસક્ત છે. ઘરના, પરિવારના મોહમાં એમની બુદ્ધિ બાંધેલી છે, એ તો નર્કમાં જનારા વિષયોનું વારંવાર સેવન કરનાર છે. એમની બુદ્ધિ તો પોતાના પ્રયત્નોથી પણ શું પણ બીજાની પ્રેરણાથી પણ ભગવાન જોડે લાગતી નથી. જે એક આંધળાને માર્ગ બતાવી શક્તો નથી. તદ્દત જેમણે સાંસારિક સુખોથી જ પરમપુરુષાર્થ માનેલ છે એ ભગવાનના પરમ સ્વરૂપને જાણી શકતા નથી. એ બીજાને શું કલ્યાણકારક માર્ગ બતાવી શકશે? સંપૂર્ણ કલેશ અને સર્વ અનર્થનો નાશ તો ત્યારે જ થાય છે જ્યારે બુદ્ધિ ભગવાનના શ્રીચરણે લીન થાય છે, પરંતુ જ્યાં સુધી મહાપુરુષની ચરણરજ મસ્તક પર ધારણ ન કરીએ ત્યાં સુધી બુદ્ધિ નિર્મળ થઈને ભગવાન જોડે લાગતી નથી.'

નાનકડો બાળક ત્રિભુવન વિજયી દૈત્ય સામે નિર્ભય થઈને ઉપર પ્રમાણે એના શત્રુનો પક્ષ લઈને સમર્થન કરે છે, આ દૈત્યરાજાને અસહ્ય લાગ્યું. જોરથી બૂમ મારી તેણે પોતાના ક્રુર દૈત્યોને આજ્ઞા કરી કે; 'તાત્કાલિક આ દુષ્ટને મારી નાખો, હમણાં જ આનો નાશ કરો, કોઈપણ પ્રકારનો વિચાર ન કરતા, આનો નાશ કરવો જોઈએ. સોનું કેટલું ય મુલ્યવાન હોય તો પણ જેના કારણે કાન તૂટવાનો સમય આવે છે એ સોનું કાનમાં રાખવાનો શું લાભ? હમણાં ને હમણાં આ દુષ્ટનો વધ કરો!!!

●●●

નિવેદન

સત્પંથ પ્રકાશ સમિતિ - પ્રેરણાપીઠ, પીરાણામાં નીચે મુજબની જગ્યાઓ પ્રચાર-પ્રસાર માટે વેતન અથવા માનદ્ સેવાથી ભરવાની છે. આ જગ્યાઓ પર ઈચ્છુક ઉમેદવારે પોતાના બાયોડેટા સાથે લેખિતમાં અરજી પોષ્ટ અથવા રૂબરૂમાં તા. ૩૦-૧૦-૨૦૧૫ સુધીમાં સત્પંથ પ્રકાશન સમિતિના કાર્યાલયમાં મળી જાય તે રીતે કરવા વિનંતી છે.

નોંધ : સત્પંથી ઉમેદવારની પ્રથમ પસંદગી રહેશે.

- કોમ્પ્યુટર ઓપરેટર (ગ્રાફીક્સ ડીઝાઈનર જાણકાર, ગુજરાતી-હિન્દી-અંગ્રેજી મેટર કંપોઝ કરી શકે તેવા.
- સરક્યુલર મોબાઈલવાન ડ્રાયવર (ડ્રાઈવીંગ લાઈસન્સ જરૂરી)

લી.

સંપાદકશ્રી : સત્પંથ પ્રકાશ સમિતિ, પ્રેરણાપીઠ, પીરાણા
તા. દસક્રોઈ, જી. અમદાવાદ-૩૮૨૪૨૫
સંપર્ક ફોન : ૦૨૭૧૮-૨૮૮૮૧૨

realpatidar.com

https://archive.org/details/bk1421/page/n8/mode/1up

realpatidar.com

શ્રાદ્ધ

- બાબુભાઈ એસ. પટેલ, અમદાવાદ

હિન્દુ ધર્મશાસ્ત્રમાં શ્રાદ્ધપક્ષનું વિશેષ મહત્ત્વ હોય છે. ભાદરવા માસના કૃષ્ણ પક્ષના પંદર દિવસ 'પિતૃપક્ષ'ના નામથી પ્રખ્યાત છે. આ દિવસોમાં પંદર દિવસોમાં પંદર દિવસ સુધી ખાસ કરીને હિન્દુઓમાં પિતૃતર્પણ કરવાનો જૂનો રિવાજ છે. એમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવાનું હોવાથી શ્રાદ્ધના પંદર પિતૃપક્ષ પણ કહેવાય છે. આ શ્રાદ્ધ સદીઓથી હિન્દુધર્મમાં કર્મકાંડના વિધિઓ પ્રમાણે કરવામાં આવે છે.

પહેલાનાં વખતમાં માનવીને મૃત્યુની ખબર પણ નહોતી કે મૃત્યુ પછી શું કરવું? એવી દ્વિધામાં નિષ્પ્રાણ દેહને સાચી રાખવામાં આવતો. ખુલ્લામાં પડી રહેલો દેહ સડીને નષ્ટ થઈ જતો. એમાંથી રોગો પણ ઉત્પન્ન થતા.

આટલી સમજ આવ્યા પછી મૃત્યુનો સંબંધ ઈશ્વર સાથે જોડવામાં આવ્યો. મૃત માનવી દેવતત્ત્વમાં સમાઈ જાય છે એવી સમજણ માનવીને આવ્યા પછી મૃતદેહને સંભાળી રાખવા માટે તેને જમીનમાં દાટી દેવા લાગ્યા.

એમાંયે નષ્ટ થતો જોઈને દેહનું સમીકરણ શરૂ થયેલું. ત્યાર બાદ આત્માની શાંતિ અને કલ્યાણ માટે શ્રાદ્ધ કરવાનો રિવાજ ધીરે ધીરે પ્રચલિત બન્યો.

લગભગ ઈ.સ. ૬૦૦ વર્ષ પૂર્વે ધર્મશાસ્ત્રકારોએ શ્રાદ્ધ પર વિસ્તૃત ચર્ચા કરી છે. આમ સ્તંભ ધર્મસૂત્રમાં કહેવાયું છે કે, પહેલાંના સમયમાં મનુષ્ય અને દેવો આ જ લોકમાં વાસ કરતા હતા. દેવો યજ્ઞને કારણે સ્વર્ગમાં જતા રહ્યા, પરંતુ માનવીઓ અહીં જ રહી ગયા જે માનવીઓ દેવોની જેમ યજ્ઞ કરે છે તેઓ પરલોકમાં જઈને બ્રહ્માની સાથે નિવાસ કરે છે. આ પરિસ્થિતિ જોઈને એ સમયે મનુએ શ્રાદ્ધની શરૂઆત કરી હતી.

શ્રાદ્ધની શરૂઆત વર્ષો પહેલાં દિવસથી કરવામાં આવતી હતી.

સૌથી પહેલું શ્રાદ્ધ મહાભારતકાળમાં મહાઋષિ દત્તાત્રેયના મહાતપસ્વી પુત્ર નિમીએ કર્યાનો પુરાણમાં ઉલ્લેખ છે. નિમીનો શ્રીમાન નામનો પુત્ર મરણ પામ્યો ત્યારે એના દુઃખથી ખિન્ન બનેલા નિમીએ દીકરાની યાદમાં અનેકવિધ ચીજો દાનમાં આપીને અજાણતામાં જ શ્રાદ્ધ કરેલું. ત્યારથી શ્રાદ્ધ કરવાનો રિવાજ ઋષિમુનિઓએ શરૂ કર્યો હતો.

શ્રાદ્ધના પર્વ સાથે દાનવીર કર્ણની કથા પણ જોડાયેલી છે. એમ કહેવાય છે કે, કર્ણ રોજ સવા મણ સોનું દાન કરતો હતો. દાનવીર કર્ણ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે સ્વર્ગમાં એનો સોનાનો મહેલ તૈયાર હતો. મહેલમાં સોનું સિવાય કશું જ નહોતું. એનું કારણ જણાવતાં જણાવેલું કે, આ દુનિયામા જે કંઈ દાન કરે એ જ સ્વર્ગમાં એને આપવામાં આવે છે. આ જવાબ સાંભળીને ખિન્ન થયેલા કર્ણે દેવરાજ ઈન્દ્રને ખાસ વિનંતી કે, પોતાને ૧૫ દિવસ પૃથ્વી પર પાછા રહેવા જવાની છૂટ માગી. તેથી ઈન્દ્રદેવની મહેરબાનીથી કર્ણ ૧૫ દિવસ માટે પૃથ્વી પર પાછો આવ્યો અને ત્યારે અનેકવિધ આઠ વસ્તુઓનું દાન-પુણ્ય કર્યું.

શ્રાદ્ધનો અર્થ થાય છે - શ્રદ્ધાથી જે કંઈ આપવામાં આવે તે પિતૃપક્ષમાં પિતાની મૃત્યુતિથિના દિવસે જળ, તલ, કુશ, અક્ષત્, દૂધ અને પુષ્પ વગેરેથી શ્રદ્ધાપૂર્વકનું એમનું શ્રાદ્ધ સંપન્ન કરવું જોઈએ. વાસ્તવમાં સાચું શ્રાદ્ધ એ પિતૃઓના સદ્‌ગુણો અને સંસ્કાર વારસો જીવનમાં ઉતારવાના પવિત્ર દિવસો છે.

માતા-પિતાનું શ્રાદ્ધ કરનાર પુત્ર પોતાનાં માતા-પિતાના ઋણમાંથી સર્વદા માટે મુક્ત થઈ જાય છે. જે માતા-પિતાએ પુત્રોને ઉછેરવા માટે કઠોર કષ્ટો સહન કર્યા છે, એમના ઋણને ન ચુકવવું એ કૃતઘ્નતા ગણાય.

ધર્મશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, પિતૃઓનું શ્રાદ્ધ કરનાર ગૃહસ્થ દીર્ધાયુ, પુત્ર-પૌત્રાદિ, યશ, સ્વર્ગ, પુષ્ટિબલ, લક્ષ્મી, પશુ, સુખ-સાધન તથા ધન-ધાન્યાદિની પ્રાપ્તિ મેળવે છે.

માતાના શ્રાદ્ધ માટે નોમ પુણ્યદાયી માનવામાં આવે છે. એથી તો તમામ મૃત સ્ત્રીઓનું સામૂહિક શ્રાદ્ધ એ જ દિવસે કરવામાં આવે છે. જ્યારે ભાદરવા વદ ચૌદશે નાનાં બાળકોનું 'બાળાભોલા' નું શ્રાદ્ધ કરવામાં આવે છે.

ગુજરાતમાં શ્રાદ્ધમાં બીજા વિધિ સાથે 'કાગવાસ' નાખવાનો રિવાજ પણ પ્રચલિત છે. ●●●

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1421/page/n9/mode/1up

realpatidar.com

Shivpura Kampa,
Dhansura,
Satpanth Khana

ૐ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન જ્યોત મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મુ. શીવપુરાકંપા, તા. ધનસુરા, જી. અરવલ્લી. (તા. ૨૦-૯-૨૦૧૫)

- બાબુભાઈ એચ. પટેલ, અમરગઢ કંપા.

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના સીકાથી હિંમતનગર હાઈવે રોડ પર આવેલ શીવપુરાકંપાનું લગભગ ૭૦ વર્ષ પહેલાં સ્વ. મુખી શ્રી હરજીભાઈ લાલજીભાઈ છાભૈયા તથા મતાદાર સ્વ. શ્રી હરજીભાઈ વાલજીભાઈ પોકાર એ ગામની સ્થાપના કરી તોરણ બાંધેલ ત્યારે ૐ શ્રી નારાયણ ભગવાન જ્યોતિ મંદિરની પણ પ્રતિષ્ઠા કરેલ. આ મંદિર જીર્ણશીર્ણ થવાથી સ્વ. મુખીશ્રી હરજીબાપાએ પ.પૂ. જગદ્‌ગુરુ સત્‌પંથાચાર્ય શ્રી નાનકદાસજી મહારાજની પ્રેરણાથી ચાર વર્ષ અગાઉ ગ્રામજનોની મીટીંગ બોલાવેલ અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે ભંડોળ એકત્ર કરેલ, પરંતુ મંદિર નિર્માણનું કામ ચાલુ થાય તે પહેલાં મુખી શ્રી હરજીબાપા સ્વધામ પધાર્યા. તેમની ઈચ્છા અને કામને પૂર્ણ કરવા યુવાનોએ ચાલુ વર્ષે મંદિર જીર્ણાદ્ધાર થતાં 'ૐ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન જ્યોતિ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા' પ.પૂ. જગદ્‌ગુરુ સત્‌પંથાચાર્ય શ્રી નાનકદાસજી મહારાજના આશીર્વાદથી પ.પૂ. સંત શીરોમણી શ્રી તુલસીબાપાના સાનિધ્યમાં તથા સમાજ અને ગામના ધર્મપ્રેમી હરિભક્તોની ઉપસ્થિતિમાં સંવત ૨૦૭૧ના ભાદરવા સુદ-૭ ને રવિવાર તા. ૨૦-૯-૨૦૧૫ના શુભ દિને સવારે ૯.૦૦ કલાકે રાખવામાં આવી હતી.

સવારે ૭.૦૦ કલાકે પૂજ્ય સંતોનાં આગમન થતાં તેમનું ઘડીવાળી બહેનો તથા ગ્રામજનો-હરિભક્તો દ્વારા વાજતે ગાજતે સ્વાગત સામૈયું કરવામાં આવ્યું.

ધર્મસભામાં ગામની દીકરીઓ દ્વારા પ્રાર્થના 'તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું, તું મને ત્યાં સ્થાન આપી દે' થી શરૂ કરવામાં આવી. પ્રથમ સંતો તથા ગામના વડીલ માવિત્રોનાં ચરણામૃત લઈ ચંદન-અક્ષત-પુષ્પ અને આરતીથી પૂજન કરવામાં આવ્યું.

ત્યારબાદ સ્વાગત પ્રવચન કરતાં શ્રી ડૉ. છગનભાઈ હરજીભાઈ પટેલે (શિવપુરાકંપા,) કહ્યું કે; અમારા ગામ શીવપુરાકંપામાં પરમકૃપાળું પરમાત્માની અસીમ કૃપાથી જીર્ણોદ્ધાર થયેલ મંદિરમાં ૐ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત પ.પૂ. સંતશ્રી તુલસીબાપા તથા પૂ. કરશનબાપા તથા સમાજના, ગામના ધર્મપ્રેમી મહેમાનોનું કંપાના ગ્રામજનો વતી હાર્દિક સ્વાગત કરું છું.

સ્વ. હરજીબાપાની ત્રણ મહેચ્છા હતી એક મંદિર નવ નિર્માણ, બીજું સમાજવાડી, ત્રીજું ગામમાં પાણી વ્યવસ્થા. આજે મંદિર નિર્માણની તેમની ઈચ્છા પૂર્ણ થાય છે. સ્વ. હરજીબાપા શિક્ષણના અગ્રણી હતા. આર્થિક પરિસ્થિતિ મધ્યમ હોવા છતાં મને ડૉક્ટર બનાવ્યો. સમાજમાં પણ શિક્ષણ માટે યુવાનોને માર્ગદર્શન પુરું પાડ્યું. વડીલોએ ગામનો સંપ-સંગઠનથી વિકાસ કર્યો છે.

શ્રી કરશનભાઈ વશરામભાઈ પટેલ (કર્મભૂમી, વક્તાપુર) :- ગામનો સંપ, સરકારની ભાવના જોઈ મને આનંદ થયો. ધર્મના ભેદ-ભાવ વગર મંદિર નિર્માણ તથા ગામના વિકાસનાં કાર્ય જોઈ મને આનંદ થયો. મંદિર આકાર છે શરીર સાકાર છે. મંદિરમાં શિખર એટલે ઉંચામાં ઉંચું સ્થાન અને ઝીણામાં ઝીણું સુક્ષ્મ સ્થાન, આપણા શરીરમાં પણ મસ્તિકમાં દશમું દ્વાર. પ્રાણ દશમા દ્વાર ઝીણામાં ઝીણી જગ્યાએ જાય ત્યો શીવ અને જીવનું મિલન થાય છે. ઘીની જ્યોત પ્રાણનું પ્રતિક છે. શક્તિ છે જે આદ્યશક્તિ રૂપે છે. ધ્વજ એ પરમાત્માનું પ્રતિક છે. જે ઉંચે પહોંચવાનો સંદેશ આપે છે. ધ્વજ મુક્તપણે ફરકે છે છતાં દંડ સાથે સ્થિર રહે છે. આપણે પણ ગમે ત્યાં હોઈએ ધર્મ રૂપી

realpatidar.com

https://archive.org/details/bk1421/page/n10/mode/1up

2015-10 -Satpanth Prakash (1421)

દંડને છોડવાનો નથી. મનને સદ્‌ગુરુ તેમજ શ્રી નિષ્કલંકી નારાયણમાં સ્થિર રાખવાનું છે. બ્રહ્માના આહવાનથી કર્તાયુગનો ઋગ્વેદ, ત્રેતાયુગનો યજુર્વેદ, દ્વાપર યુગનો સામવેદ - અને છેલ્લે તે કલિયુગનો અથર્વવેદ પ્રગટ થયા. મંદિરમાં ગાદી આવનાર શ્રી નિષ્કલંકી ભગવાનના આગમની નિશાની છે. વારિયજ્ઞ મહામંત્રોનું મનન કરો. શિક્ષાપત્રીના નિયમોનું પાલન કરો. આહાર-વિહાર શુદ્ધ રાખો તો પરમાત્માનાં જરૂર દર્શન થશે. જેમ દૂધમાં ઘી છે પણ દેખાતું નથી. દહીં, છાશ, માખણ અને પછી ઘી મળે છે તેમ કર્મકાંડ, ભક્તિ, તપ, વ્રત નિયમ વગર પરમાત્મા મળતા નથી. શિખરની જેમ ગામ ઊંચું રહે, ઊંચા વિકાસના શિખરો સર કરે.

પ.પૂ. સંત શ્રી તુલસીબાપા - પાવનધામ (વડાલીકંપા) એ તેમની વાણીમાં કહ્યું કે; ૐ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન મંદિરના પુનઃપ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવના પાવન પ્રસંગે સ્વ. મુખીશ્રી હરજીબાપાને જરૂર યાદ કરીશું. જેમણે આ મંદિર નિર્માણની પ્રેરણા આપી. તેમના આત્માને આજે આનંદ અને શાંતિ મળશે, બાપાનો આત્મા આપણી સાથે જ છે અને રહે છે. તેમના આશીર્વાદ ગામ ઉપર વરસતા રહેશે. આપણે સત્પંથમાં બતાવેલ શિક્ષાપત્રીના નિયમોનું પાલન કરીએ. 'પડી, જડી, વસ્તુ લેવી નહિ, ચોખ્ખાઈ ચતુરાઈમાં રહેવું' 'દિન પરતે કરો ધામશું ધંધા, સાંજ પડે થાઓ સાહેબકા બંદા.' દિવસ દરમ્યાન જે કંઈ કામ હોય તે કરો પણ સાંજે સો કામ મૂકીને પણ પ્રભુ સ્મરણ - મંદિર દર્શન કરો. આપણું શરીર પાંચ તત્ત્વનું પૂતળું છે. અંદર જે બેઠો છે તે અજર-અમર છે તેને ઓળખો. 'દાન કરો તો સુપાત્રને કરો.' ખરા દિલથી ગદ્‌ગદ્ કંઠે કરેલ પ્રાર્થના કદી અફળ જતી નથી. આપણા વડીલો ભક્તિ કરી ગયા તેમની સમાધિએ શ્રીફળ અને ધજા ચઢે છે. 'રાત્રે વહેલા જે સૂએ, વહેલા ઉઠે વીર, બળ, બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર.' વહેલી સવારે પશુ-પક્ષી-બાળકો સૂતા હોય, શાંતિ હોય ત્યારે, પ્રભુ સ્મરણ કરો. જન્મ એક જ વખત, મરણ એક જ વખત, ગુરુ એક જ, આસન એક જ, મંત્ર એક જ, માળા એક જ હોય તો બેડો પાર થાય.

કાયા કસ્યા વિના જોગ નહિ સૂજે....

અડસઠ તીરથ મા-બાપના ચરણમાં છે. મા-બાપને ભૂલશો નહિ. આહાર એવો ઓડકાર, ખોરાક શુદ્ધ રાખો, જેવું કર્મ કરશું તેવું ફળ મળશે. મંદિરે જઈ પાપ પ્રકાશો તો જેશલની જેમ તરી જવાશે. આશીર્વાદ છે કે ભગવાન ગામની ચઢતી રાખે. જેમણે તન-મન-ધનથી ભોગ આપ્યો હોય તેમના પરિવારની ધંધા રોજગારમાં પ્રગતિ અને ચઢતી રાખે, સૌ સુખી રહે, વાટે-ઘાટે દુઃખ દૂર થાય.

ત્યારબાદ સંતો તથા પાંચ મુખીના હસ્તે ૐ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના સિંહાસનની સ્થાપના, શ્રી આદ્યશક્તિ માતાજીની અખંડ જ્યોત તેમજ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ ત્રિદેવ જ્યોતિ પ્રાગટ્ય વિધિ શાસ્ત્રોક્ત રીતે ચારે વેદની ગાયત્રી મંત્રો સાથે કરવામાં આવી અને વારિયજ્ઞ, કુંભ, કળશ મહાપૂજા કરી પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન કરવામાં આવ્યો.

અંતમાં આભાર વિધિ :- શ્રી કાન્તિભાઈ સવજીભાઈ પોકારે કરતાં કહ્યું કે; પ્રથમ આભાર જેમણે આ પ્રેરણા આપી એવા પરમકૃપાળુ પરમાત્માનો, જેમના આશીર્વચનથી પ્રસંગ સંપન્ન થયો તેવા પ.પૂ. જગદ્‌ગુરુ સત્પંથાચાર્ય શ્રી નાનકદાસજી મહારાજ. પૂ. સંત શ્રી તુલસીબાપા તથા ધર્મ પ્રેમીજનો ઉપસ્થિત રહી મહોત્સવને દીપાવ્યો તેમનો આભાર. આ પ્રસંગને આયોજન બંધ કાર્યક્રમ બનાવવા માટે પ્રયત્ન કર્યા તેવા શ્રી અંબાલાલભાઈ - કરસનપુરા, શ્રી બાબુભાઈ - અમરગઢ, શ્રી સવજીભાઈ તથા ગામના કાર્યકર ભાઈઓનો આભાર. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર શ્રી રમેશભાઈ ચોધરી સાહેબનો આભાર. નામી-અનામી જેમણે સહયોગ આપ્યો તે સૌનો આભાર.

●●●

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com
Page 9 of 11

https://archive.org/details/bk1421/page/n11/mode/1up

realpatidar.com

૧૦૦૦૦ થી વધુ મંત્રજાપ સંખ્યા જે યુવાનો તથા વડીલોની છે તેમની ફોટા સાથે નામાવલી

જીજ્ઞાબેન જે. પટેલ
વડાગામ-ધનસુરા
જાપ સંખ્યા-૧૦૧૬૮

ક્રિષ્ણાબેન એન. પટેલ
વડાગામ-ધનસુરા
જાપ સંખ્યા-૧૦૧૬૮

જીનલબેન આર. રૂડાણી
દુર્ગાપુર-માંડવી
જાપ સંખ્યા-૧૦૧૬૮

સ્મિતાબેન ડી. વાસાણી
રાયણમોટી-માંડવી
જાપ સંખ્યા-૧૦૧૬૮

દિવ્યાબેન આર. પારસીયા
નાના અંગીયા-નખત્રાણા
જાપ સંખ્યા-૧૦૧૬૮

અંજુબેન એ. પટેલ
જામઠાકંપા-ધનસુરા
જાપ સંખ્યા-૨૦૦૦૦

પ્રેમીલાબેન વી. પટેલ
સ્વીપુરા કંપા-વડાલી
જાપ સંખ્યા-૧૦૧૬૮

અનુબેન પી. પોકાર
સ્વીપુરાકંપા-વડાલી
જાપ સંખ્યા-૧૦૧૬૮

ભાવિશાબેન એ. પરમાર
નરસંડા
જાપ સંખ્યા-૧૦૧૬૮

જયશ્રીબેન બી. અંધારીયા
ઘોઘા સર્કલ-ભાવનગર
જાપ સંખ્યા-૧૦૧૬૮

ધર્મિષ્ઠાબેન એમ. પટેલ
રત્નાગીરી-મહારાષ્ટ્ર
જાપ સંખ્યા-૧૦૧૬૮

કૃપેશાબેન એમ. પટેલ
માંજરોલ-વડોદરા
જાપ સંખ્યા-૮૫૦૦૦

ભાવનાબેન આઈ. પટેલ
ચાંપલપુરફાર્મ-દહેગામ
જાપ સંખ્યા-૧૦૧૬૮

કલ્પનાબેન સી. રાણા
બહુચરાજીપોળ-ખંભાત
જાપ સંખ્યા-૧૦૧૬૮

પાર્વતીબેન એન. પટેલ
છાણી-વડોદરા
જાપ સંખ્યા-૧૦૧૬૮

શાંતાબેન આર. પટેલ
રાનપુરાકંપા-ખેડા
જાપ સંખ્યા-૧૦૧૬૮

ધારાબેન જી. રામાણી
નાની વિરાણી-કચ્છ
જાપ સંખ્યા-૧૦૧૬૮

જ્યોત્સનાબેન જે. પટેલ
શંકરપુરાલાટ-કપડવંજ
જાપ સંખ્યા-૧૦૧૬૮

રૂક્ષ્મણીબેન બી. પટેલ
શંકરપુરાલાટ-કપડવંજ
જાપ સંખ્યા-૧૦૧૬૮

નર્મદાબેન સી. પટેલ
ઉપવન સોસા.-ઈડર
જાપ સંખ્યા-૧૧૦૦૦

ચીમનલાલ કે. પટેલ
ઉપવન સોસા.-ઈડર
જાપ સંખ્યા-૧૧૦૦૦

કાન્તીભાઈ આર. ધોળુ
માધવકંપા-બાયડ
જાપ સંખ્યા-૩૪૫૬૦

કૌશલકુમાર જે. રાણા
અલીંગદલાલખડકી-ખંભાત
જાપ સંખ્યા-૧૯૨૨૪

સાકરલાલ વી. મુખી
બેગમપુરા-સુરત
જાપ સંખ્યા-૧૦૧૬૮

વિરેન્દ્રકુમાર એમ. રૂડાણી
નાનાઅંગીયા-નખત્રાણા
જાપ સંખ્યા-૨૦૦૦૦

દિપેશકુમાર વી. રૂડાણી
કુરબઈ-નખત્રાણા
જાપ સંખ્યા-૧૦૧૬૮

નાનજીભાઈ આર. પટેલ
તળાવકંપા-મોડાસા
જાપ સંખ્યા-૨૦૦૦૦

દિનેશકુમાર જે. પટેલ
માનવમંદિર-અંકલેશ્વર
જાપ સંખ્યા-૧૦૧૬૮

રમણભાઈ એસ. પટેલ
અમીનપુરાલાટ-ખેડા
જાપ સંખ્યા-૧૦૧૬૮

મહેન્દ્રભાઈ કે. અંધારીયા
સુભાષનગર-ભાવનગર
જાપ સંખ્યા-૪૦૦૦૦

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1421/page/n12/mode/1up

realpatidar.com

Registered under RNI No. GUJ - GUJ - 2012/42296. Dt. 18-05-2012.
Registered Under Postal Registration No. GAMC - 1830/2015-2017 By S.S.P. Ahmedabad City DN
Valid up to 31st December 2017. Posted on 15th Every Month from PSO Patrika Channal Ahmedabad - 380002.
દર માસની ૧૫ તારીખે પ્રસિધ્ધ થતું માસિક

Brijesh Patel
+91 99742 64444

Tarun Patel
+91 90991 16999

Feel your Dreams...

Satyam Auto Consultant

All Type of Car Sales & Parches

1-A, Jayvijay Society, Opp. Paliyadnagar Garden,
Nr. Devendra Bus Stop, Naranpura, Ahmedabad.

:- નીતિસૂત્ર -:

- જે મનુષ્ય નિશ્ચિતને છોડીને અનિશ્ચિતની પાછળ ભાગે છે તેનું નિશ્ચિત કાર્ય અથવા પદાર્થ નષ્ટ થઈ જાય છે અને અનિશ્ચિત તો નષ્ટ થાય જ છે.
- બુદ્ધિમાન પુરુષે શ્રેષ્ઠ કુળમાં જન્મેલી કુરૂપ કન્યા સાથે પણ વિવાહ કરી લેવા જોઈએ, પરંતુ નીચ કુળમાં જન્મેલી સુંદર કન્યાની સાથે ક્યારેય વિવાહ ન કરવા જોઈએ.

રવાના :
સતપંથ પ્રકાશ
સતપંથ પ્રકાશન સમિતિ
પ્રેરણાપીઠ, પીરાણા, તા. દસક્રોઈ,
જિ. અમદાવાદ - ૩૮૨ ૪૨૫.

To, ______________________

Printed, and Published by **SHAMJIBHAI K. PATEL on behalf of Satpanth Prakashan Samiti** and Printed at **Smruti Offset,** B/5, Ravi Estate, Rustom Mill Compound, Near Torrent Power, Near Water Tank, Dudheshwar, Ahmedabad - 380 004 and published from Satpanth Prakashan Samiti, Shri Satpanth Prernapith, At - PIRANA - 382 425, Taluka - Dascroi, Dist. Ahmedabad.
Editor - **SHAMJIBHAI K. PATEL**

realpatidar.com